

- 1 ✓ Choice of particular graph depends on :
- (A) Purpose of the study (B) Type of the audience
  - (C) Nature of the data (D) All of the above
- ચોક્કસ ગ્રાફની પસંદગી \_\_\_\_\_ પર આધાર રાજે છે.
- (A) અભ્યાસના હેતુ (B) પ્રેક્ષકોના પ્રકાર
  - (C) માહિતીના સ્વરૂપ (D) ઉપરોક્ત તમામ
- 2 ✓ The basis of corporate tax is -
- (A) Total turnover of the company
  - (B) Profit after distribution of dividend
  - (C) Profit before distribution of dividend
  - (D) Total Capital employed in the company
- કોર્પોરેટ ટેક્ષ શેના આધારે ગણાય છે ?
- (A) કંપનીનું કુલ ટર્નઓવર
  - (B) ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો
  - (C) ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો
  - (D) કંપનીમાં રોકાયેલી કુલ મૂડી
- 3 ✓ મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડીકૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ?
- (A) 5 એપ્રિલ (B) 6 એપ્રિલ
  - (C) 7 એપ્રિલ (D) 8 એપ્રિલ
- 4 ✓ The optimum output is the one which is produced -
- (A) By the optimum firm.
  - (B) At the maximum average cost.
  - (C) At the minimum average cost.
  - (D) At zero marginal cost.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભૂતિ અનુભૂતિ અને અનુભૂતિ અનુભૂતિ
- (A) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનુભૂતિ અનુભૂતિ
  - (B) મહત્વાની નિર્માણ અનુભૂતિ અનુભૂતિ
  - (C) લઘુત્તમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય
  - (D) શૂન્ય સીમાંત ખર્ચ પર ઉત્પાદન થાય
- 5 ✓ 'પ્રધાનમંત્રીની નિમણૂક રાખ્યું કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાખ્યું પણ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આંદ્રકલ જણાવો.
- (A) આંદ્રકલ-68 (B) આંદ્રકલ-75
  - (C) આંદ્રકલ-51 (D) આંદ્રકલ-74

**6** In which method of the following methods the value of closing stock is near to market price ?



નીચેની પદ્ધતિની કઈ પદ્ધતિમાં આખર સ્ટોકનું મૂલ્ય બજાર ભાવની નજીક હોય છે ?



7 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાયાયોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?



8 Which objectives government attempts to obtain by budget ?

- (A) To promote economic development
  - (B) Balanced regional development
  - (C) Redistribution of income and wealth
  - (D) All of the above

બજેટ દ્વારા સરકાર ક્યો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ?

- (A) આર્થિક વિકાસને પ્રોત્સાહન
  - (B) સંતુલિત પ્રાણીક વિકાસ
  - (C) આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ
  - (D) ઉપરોક્ત તમામ

9 At the end of the fiscal year, Accounts Receivable has a balance of Rs. 1,00,000 and Bad Debts Reserve Account has a balance of Rs. 7,000. The expected net realizable value of the accounts receivable is ?



(C) કા. ૧,૦૦૧ નાણાકીય વર્ધના અંતે, દેવાદારો રૂ. 1,00,000 અને ઘાલખાય અનામત ખાતું રૂ. 7,000 છે. દેવાદારો પાસેથી મળવાપાત્ર રકમનું અંદાજ ચોખું વાસ્તવિક મૂલ્ય શું છે ?

10 The present financial statements are presented by which approach ?

- (A) Revaluation value approach
- (B) Historical cost value approach
- (C) Present purchasing power approach
- (D) Gross assets approach

વર્તમાન નાડાકીય પત્રકો ક્યા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ?

- (A) પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ
- (B) ઐતિહાસિક પડતર કિંમત અભિગમ
- (C) વર્તમાન ખરીદ શક્તિ અભિગમ
- (D) કુલ સંપત્તિનો અભિગમ

11 Fill in the blank.

Every man, woman and child \_\_\_\_\_ lost.

- (A) were
- (B) are
- (C) was
- (D) have

12 Which of the following would be considered a risk-free Investment ?

- (A) Gold
- (B) Equity
- (C) High grade corporate bond
- (D) Treasury bills

નીચેના પૈકી શાને જોખમ રહિત રોકાણ ગણી શકાય ?

- (A) સોનું
- (B) ઇક્વિટી
- (C) ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ
- (D) ટ્રેઝરી બિલ

13 સંસ્કાર - સમન્વયના જે યુગને વિજ્યરાય વૈદ્ય - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને "આ વાધને કરુણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

- (A) મણિશાંકર રત્નાલ ભવ
- (B) નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
- (C) ગોવધનરામ માધવરામ ત્રિપાઠી
- (D) બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

14 Standard deviation of a sampling distribution is called :

- (A) Root mean square
- (B) Mean square error
- (C) Standard error
- (D) Non-sampling error

નિર્દર્શન વિતરણના પ્રમાણિત વિચલનને \_\_\_\_\_ કહે છે.


- (A) મૂળ સરેરાશ વર્ગ
- (B) સરેરાશ વર્ગ ભૂલ
- (C) પ્રમાણિત દોષ
- (D) બનનિર્દર્શન ભૂલ

15 ✓ નિયમિત અષ્ટકલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી ક્યું ઓટું વિધાન છે તે શોધો.

- (A) તેને છ શિરોબિંદુ છે.  
(B) તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.  
(C) તેને પરસ્પર એકરૂપ એવા જગ્ઘા વિકણો છે.  
(D) તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.

16 ✓ For which value of  $k$ ,  $f(x) = x^3 - 3x + k$  has two distinct roots in  $(0, 1)$  ?

- (A) 0 (B) -1  
(C)  $k \in \mathbb{N}$  (D) None of the above  
કની કઈ કિંમત માટે વિષેય  $f(x) = x^3 - 3x + k$  ને બે ભિન્ન મૂળ  $(0, 1)$  અંતરાલની અંદર આવે ?  
(A) 0 (B) -1  
(C)  $k \in \mathbb{N}$  (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં



17 ✓ Change the voice.

Did you attend the meeting ?

- (A) Is the meeting attended by you ?  
(B) Did the meeting attended by you ?  
(C) Yes, the meeting was attended by me.  
(D) Was the meeting attended by you ?

18 ✓ The first auditor of the company other than a government company shall be appointed by the Board of Directors within \_\_\_\_\_ days of incorporation of the company.

સરકારી કંપની સિવાયની કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કંપનીની સ્થાપનાના \_\_\_\_\_ દિવસમાં કરવામાં આવશે.

- (A) 30 (B) 60  
(C) 90 (D) 120

19 ✓ ફિલ્મ્યુટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3નું પૂરું નામ શું છે ?

- (A) Moving Pictures Extensible Group  
(B) Moving Pictures Expert Group  
(C) Moving Pictures Exchange Group  
(D) Moving Pictures Encoding Group

20 ✓ Which kind of audit is conducted generally between two annual audits ?

- (A) Internal audit (B) Interim audit  
(C) Final audit (D) Continuous audit  
ક્યા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ?  
(A) અંતરિક ઓડિટ (B) વચ્ચાળાના ઓડિટ  
(C) અંતિમ ઓડિટ (D) સતત ઓડિટ

- 21 प्रथम पांच प्राकृतिक अविभाज्य संभ्याओनी सरासरी \_\_\_\_\_ थाय.  
(A) 3.6 (B) 7.8  
(C) 3.4 (D) 5.6

- 22 Who among the following used the term 'Evergreen Revolution' for increasing agricultural production in India?  
(A) Norman Borlaug (B) M.S. Swaminathan  
(C) Raj Krishna (D) R.K.V. Rao  
भारतमાં કૃત્તિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણો 'સદાબહાર કાંતિ' શબ્દનો ઉપયોગ કરેલ છે?  
(A) નોર્મન બોલોગ (B) એમ.એસ. સ્વામિનાથન  
(C) રાજકૃષ્ણા (D) આર.કે.વી. રાવ

- 23 ખોટી જોડણી શોધો.  
(A) મુહૂર્ત (B) ચિંચારી  
(C) હરીચા (D) સારથિ

- 24 The Primary goal of the Financial Management is \_\_\_\_\_.  
(A) To maximise the return  
(B) To maximise the risk  
(C) To maximise the wealth of owners  
(D) To maximise the Profit  
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ \_\_\_\_\_ છે.  
(A) વળતર મહત્તમ બનાવવું  
(B) જોખમ મહત્તમ કરવું  
(C) માલિકોની સંપત્તિ મહત્તમ કરવી  
(D) નફો મહત્તમ કરવો

- 25 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.  
ગંજન -  
(A) તિરસ્કાર (B) અહોભાવ  
(C) મનોવ્યથા (D) ક્ષમાપના

- 26 Which of the following are tools of management accounting ?  
(A) Standard Costing  
(B) Marginal Costing  
(C) Budget and Budgetary control  
(D) All of the above  
નીચેનામાંથી ક્યા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે?  
(A) પ્રમાણ પડતર પદ્ધતિ  
(B) સીમાંત પડતર પદ્ધતિ  
(C) બજેટ અને બજેટ નિયંત્રણ  
(D) ઉપરોક્ત તમામ

27 ✓ ગુજરાત અધ્યસંખ્યક નાડાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયને આવરી લેવામાં આવેલ છે ?

- (A) સાત (B) પાંચ  
 (C) ત્રણ (D) નવ

**28** Skin colour of people of a region is :



એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ।.....

- (A) કમવાચક માહિતી નથી  
 (B) નામવાચક માહિતી  
 (C) અસતત માહિતી  
 (D) ઉપરોક્ત પેકી એકપણ નથી

**29** / Which of the following is a non-probabilistic sampling technique ?

- (A) Simple random sampling
  - (B) Stratified random sampling
  - (C) Systematic sampling
  - (D) Snowball sampling

નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મક નિર્દર્શન પદ્ધતિ છે ?

- (A) सरण यद्यपि निर्दर्शन पद्धति  
 (B) सतरीत यद्यपि निर्दर्शन पद्धति  
 (C) पटिक निर्दर्शन पद्धति  
 (D) औबोल निर्दर्शन पद्धति

**30** Which country stands at the top in Human Development Index ranking in Human Development Report 2020 ?



માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે?



31 નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્�ી નથી તે જણાવો.

- (A) વિદ્યાન  
(C) પંડિત

**32** Normally which level of Current Ratio is considered as Ideal / Satisfactory ?

સામાન્ય રીતે ચાલુ ગુણોત્તરના કયા પ્રમાણને આદર્શ / સંતોષકારક માનવામાં આવે છે ?

33 ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભોશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

- (A) એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ  
(C) ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

- (B) ધ કન્વીનીઅન્ટ એક્શન  
(D) ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

34  $\lim_{n \rightarrow \infty} \left( \frac{1}{x} - \frac{1}{e^x - 1} \right) = \underline{\hspace{2cm}}$

- (A) 0  
(C) 1

- (B)  $\frac{1}{2}$   
(D) Can't be determined

$$\lim_{n \rightarrow \infty} \left( \frac{1}{x} - \frac{1}{e^x - 1} \right) = \underline{\hspace{2cm}}$$

- (A) 0  
(C) 1

- (B)  $\frac{1}{2}$   
(D) ના મેળવી શકાય

35 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપેથે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર્યું કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

- (A) 80 મીટર  
(C) 120 મીટર

- (B) 100 મીટર  
(D) 180 મીટર

36 If the gross profit is Rs. 5,000 and the net profit is 25% of the gross profit. The expenses must be ?

- (A) Rs. 3,750  
(C) Rs. 4,150

- (B) Rs. 1,250  
(D) Rs. 6,250

જો કાચો નંખો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નંખો એ કાચા નંખાના 25% છે, તો ખર્ચ કેટલા હોવા જોઈએ ?

- (A) રૂ. 3,750  
(C) રૂ. 4,150

- (B) રૂ. 1,250  
(D) રૂ. 6,250

37 કમ્પ્યુટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફરવીને સુરક્ષિત રાખવાની કણાને શું કહે છે ?

- (A) સાંકેતિકરણ  
(C) સિક્યુર સોકેટ લેયર

- (B) બિન્સાંકેતિકરણ  
(D) વેરિસાઈન

આধુનિક ભાડાના સિદ્ધાંત મુજબ ભારું શેના પર ઉદ્ઘભવે છે ?



- 39 નેશનલ ટ્રસ્ટ એકટ ક્યા વર્ષમાં ઘણવામાં આવ્યો ?

- (A) 2003      (B) 1999  
 (C) 1992      (D) 1990

- 40** In case of perfect substitutes indifference curve is - 10  
 (A) Right angled      (B) Linear upward sloping  
 (C) Linear downward sloping      (D) Concave to origin

સંપૂર્ણ અવેજ વસ્તુઓ માટે તટસ્થ રૈખા કેવી હોય છે ?  
 (A) જમણી બાજુ ખૂણો ધરાવતી 30      (B) સુરેખ ધન ઢાળવાણી  
 (C) સુરેખ ઋણ ઢાળવાણી 84      (D) અંતઃગોળ

સંપૂર્ણ અવેજુ વસ્તુઓ માટે તટસ્થ રૈખા કેવી હોય છે ?

- (A) જમણી બાજુ ખૂણો ધરાવતી (B) સુરેખ ધન ઢાળવાળી  
 (C) સુરેખ ઋણ ઢાળવાળી (D) અંતઃગોળ

- 41 ટેલેટ કમ્પ્યુટરના બે પ્રચલિત પ્રકાર ક્યા છે ?

(A) PDAs ટેલેટ, કન્વર્ટિબલ ટેલેટ (B) PDAs ટેલેટ, નોટબુક ટેલેટ  
 (C) સ્લેટ ટેલેટ, અલ્ટ્રાબુક ટેલેટ (D) સ્લેટ ટેલેટ, કન્વર્ટિબલ ટેલેટ

42 Which of the following will directly increase the Gross National Product?

- (A) A rise in prices      11      (B) A surplus in budget  
 (C) An increase in investment      (D) A deficit in budget

નીચેનામાંથી ક્યું કુલ રાખ્યીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ?

(A) કિમતમાં વધારો      10      (B) અંદાજપત્રમાં પુરાંત  
 (C) મૂડીરોકાણમાં વધારો      (D) અંદાજપત્રમાં ખાખ

નીચેનામાંથી કયું કુલ રાખ્યીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ?

- (A) કિમતમાં વધારો      0      (B) અંદાજપત્રમાં પુરાંત  
 (C) મૂડીરોકાણમાં વધારો      0      (D) અંદાજપત્રમાં ખાખ

- 43 54 km/h ની અચળ ઝડપે ગતિકરતી ટ્રેનની ઝડપ  $ms^{-1}$  ના એકમમાં કેટલી થાય ?

(A)  $15 ms^{-1}$       (B)  $90 ms^{-1}$   
 (C)  $1.5 ms^{-1}$       (D)  $9 ms^{-1}$



49 નીચે આપેલ વાક્યનો ધોરણ કર્તારિપ્રથોગ જ્ઞાવો.

એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

(A) એ દશ્ય હું ભૂલું એમ નથી.

(B) એ દશ્ય હું ભૂલી ગયો.

(C) એ દશ્ય હું ભૂલી જઈશ.

(D) એ દશ્ય હું ભૂલું છું.

50 Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) provides access to which of the following financial services ?

(A) Pension

(B) Insurance

(C) Banking Savings and Deposit Accounts

(D) All of the above

પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ?

(A) પેન્શન

(B) વીમો

(C) બેંકના બચત અને થાપણ ખાતા

(D) ઉપરોક્ત તમામ

51 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.

બોડીને ત્યાં વળી કાંઈકી કેવી ?

(A) બોડીને કાંસકી ખોવાઈ ગઈ.

(B) જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?

(C) તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે.

(D) વાળમાંથી ગૂંચ કાઢી શકતી નથી.

52 Let  $f(x)$  be a polynomial with real coefficient with  $f(x)$  has no multiple roots and  $f(x_1)f(x_2) < 0$ , where  $x_1 < x_2$ . Then

(A)  $f$  has exactly one root in  $(x_1, x_2)$

(B)  $f$  has even number of roots in  $(x_1, x_2)$

(C)  $f$  has odd number of roots in  $(x_1, x_2)$

(D) None of the above

વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી  $f(x)$  ને પુનરાવર્તિત મૂળ નથી તથા

$f(x_1)f(x_2) < 0$  કે જ્યાં  $x_1 < x_2$  છે, તો .....

(A)  $f$  ને એક જ મૂળ અંતરાલ  $(x_1, x_2)$ માં છે.

(B)  $f$  ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ  $(x_1, x_2)$ માં છે.

(C)  $f$  ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ  $(x_1, x_2)$ માં છે.

(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં.

૫૩ સૌરાષ્ટ્રના તુલસીશયામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણાસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કર્ષ પુરાણા પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?



54 If  $y = \sin(2x)$ , then  $\frac{d^9y}{dx^9} = \underline{\hspace{2cm}}$ .

- (A)  $29 \sin(2x)$       (B)  $\sin\left(2x + \frac{9\pi}{2}\right)$   
 (C)  $2^9 \sin\left(2x + \frac{9\pi}{2}\right)$       (D) None of the above

$$\text{If } y = \sin(2x), \text{ then } \frac{d^9y}{dx^9} = \underline{\hspace{2cm}}.$$

- (A)  $29 \sin(2x)$       (B)  $\sin\left(2x + \frac{9\pi}{2}\right)$   
 (C)  $2^9 \sin\left(2x + \frac{9\pi}{2}\right)$       (D) ઉપરોક્ત પાંકી એક પણ નહીં

55 ✓ એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને કિકેટ ટીમમાં (દરેકમાં) 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હોકી રમતા 12 ખેલાડી છે. હોકી અને કિકેટ રમતા 11 ખેલાડી છે. કિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રહે છે. તો કુલ ખેલાડી કેટલા ?



56 Fifth decile of a distribution coincide with -



વિતરણના પાંચમા દશાંશકની કિમત \_\_\_\_\_ સાથે એકાકાર થાય છે.

- 57** Which of the following is a positional average ?  
 ✓ (A) Mean (B) Median  
 (C) Geometric mean (D) All of the above  
 નીચેના પૈકી ક્યું સ્થાન આધારિત સરેરાશ છે ?  
 (A) મધ્યક (B) મધ્યસ્થ  
 (C) ગુણોત્તર મધ્યક (D) ઉપરોક્ત તમામ
- 58** Which of the following is not an instrument of Monetary Policy ?  
 ✓ (A) Open Market Operations (B) Bank rate  
 (C) Selective Credit Control (D) Government Spending  
 નીચેનામાંથી ક્યું નાણાકીય નીતિનું સાધન નથી ?  
 (A) ખુલ્લા બજારની નીતિ (B) બેન્ક દર  
 (C) પસંદગીયુક્ત શાખ નિયંત્રણ (D) સરકારી ખર્ચ
- 59** ઓટી જોડણી શોધો.  
 ✓ (A) મહુસૂદન (B) રાંગણી  
 (C) પ્રક્રિયા (D) બૂલબૂલ
- 60** If a test rejects the null hypothesis when the null hypothesis is true, it is a -  
 (A) Type-I error  
 (B) Type-II error  
 (C) Either Type-I or Type-II error  
 (D) Non-sampling error  
 નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને \_\_\_\_\_ કહે છે.  
 (A) પ્રથમ પ્રકારની ભૂલ  
 (B) દ્વિતીય પ્રકારની ભૂલ  
 (C) પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ  
 (D) અનનિદર્શન ભૂલ
- 61** રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.  
 ડાલ્ફિનને બોલવું ગમતું નથી.  
 (A) સામાન્ય કૃદંત (B) વર્તમાનકૃદંત  
 (C) ભવિષ્યકૃદંત (D) ભૂતકૃદંત

- 62) The vertical demand curve for a commodity shows that its demand is -  
 (A) Highly elastic (B) Perfectly elastic  
 (C) Perfectly inelastic (D) Less elastic  
 જો કોઈ પણ વસ્તુ માટેની માંગરેખા ઊભી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે ?  
 (A) વધુ મૂલ્ય સાપેક્ષ (B) સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ  
 (C) સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ (D) ઓછી મૂલ્ય સાપેક્ષ
- 63) Give adjective of :  
 'Float'  
 (A) floaty (B) 'A' and 'D'  
 (C) floating (D) floatable
- 64) Management accounting deals with which information ?  
 (A) Qualitative (B) Quantitative  
 (C) Both (A) & (B) (D) None of the above  
 સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ?  
 (A) ગુણાત્મક (B) સંખ્યાત્મક  
 (C) (A) અને (B) બંને (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
- 65) The retiring auditor does not have a right to \_\_\_\_\_.  
 (A) make written representations  
 (B) get his representation circulated  
 (C) speak as a member of the company  
 (D) be heard at the meeting  
 નિવૃત્ત ઓડિટરને \_\_\_\_\_ અધિકાર નથી.  
 (A) લેખિત રજૂઆત કરવાનો  
 (B) તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો)  
 (C) કંપનીના સભ્ય તરીકે બોલવાનો  
 (D) મિટિંગમાં સાંભળવાનો
- 66) AAA stands for ?  
 (A) American Accounting Agency  
 (B) American Accounting Association  
 (C) Asian Accounting Association  
 (D) Australian Accounting Association  
 AAA એટલે શું ?  
 (A) અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી  
 (B) અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન  
 (C) એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન  
 (D) ઓસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન



71 ✓ નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ \_\_\_\_\_ મિનિટ લાગશે.

(A) 2

(B) 10

(C) 6

(D) 12



72 ✓ ABC Ltd. acquired assets worth Rs. 8,10,000 from XYZ Ltd. by issue of shares of Rs. 100 at a discount of 10%. The number of shares to be issued by ABC Ltd. to settle the purchase consideration will be.....

(A) 6,000 shares

(B) 7,500 shares

(C) 9,000 shares

(D) 5,625 shares

73 ABC લિ. એ XYZ લિ. પાસેથી રૂ. 8,10,000ની મિલકતો મેળવવા રૂ. 100ના શેર, 10% વટાવે બહાર પાડે છે, તો ABC લિ. દ્વારા ખરીદ કિંમતના અવેજ પેટે બહાર પાડેલ શેરોની સંખ્યા \_\_\_\_\_ થશે.

(A) 6,000 શેર

(B) 7,500 શેર

(C) 9,000 શેર

(D) 5,625 શેર

73 ✓ 73 મુનુષ્યના હૃદયના કયા ભાગે હમેશાં ઓક્સિજનયુક્ત રૂપિર વહન પામે છે ?

(A) બંને કણકો

(B) બંને ક્ષેપકો

(C) ડાબું કણક અને ડાબું ક્ષેપક

(D) જમણું કણક અને જમણું ક્ષેપક

74 ✓ 1, 2, 3, 5, \_\_\_\_\_.

(A) 7

(B) 8

(C) 12

(D) None of the above

1, 2, 3, 5, \_\_\_\_\_.

(A) 7

(B) 8

(C) 12

(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

75 साची जोड़ही शोधो.

- (A) प्रश्नाताप  
(C) पश्नाताप

- (B) पश्नाताप  
(D) प्रश्नातप

76 The Bretton Wood System was based on -

- (A) A silver standard  
(B) A flexible exchange rate system  
(C) A gold exchange standard system  
(D) None of the above

ब्रेटनवुड प्रथा रोजा पर आधारित हતी ?

- (A) चांदी (रुक्त) धोरण  
(B) परिवर्तनशील विनिमय दर प्रथा  
(C) सोना विनिमय धोरण प्रथा  
(D) उपरोक्त पैकी एकप्रणा नहीं

77 Fill in the blank.

Kolkata is \_\_\_\_\_ from the equator than colombo.

- (A) further  
(C) more farther

- (B) farther  
(D) furthest

78 Tobin tax is tax on -

- (A) Exports  
(B) Imports  
(C) Transactions in foreign exchange  
(D) Sales

टोबिन टेक्स रोजा पर लादवामां आवे छे ?

- (A) निकासो पर  
(B) आयातो पर  
(C) विदेशी डुइयामधाना व्यवहारो पर  
(D) वेचाणा पर

79 गांधीनगर स्थित गीफ्ट सीटी(GIFT) नु पूऱ्य नाम जडावो.

- (A) गुजरात ईन्टरनेशनल फायनान्स टेक-सीटी  
(B) गुजरात ईन्डस्ट्रीयल फायनान्स टेक्नोलोजी-सीटी  
(C) गुजरात ईन्टरनेशनल फायर्स टेक-सीटी  
(D) गुजरात ईन्डस्ट्रीयल फायनान्चियल टेक्स-सीटी

80 A rise in prices before any festival is an example of -

- (A) Cyclic effect  
(C) Irregular effect

- (B) Seasonal effect  
(D) Secular effect

क्रोध पछा तडेवार पहेलां भावमां थतो वधारो ए \_\_\_\_\_ नु उदाहरण छे.

- (A) चक्रीय असर  
(C) अनियमित असर

- (B) मोसभी असर  
(D) दीर्घकालीन असर

- 81 Who appoints the Finance Commission ?  
 (A) President of India (B) Prime Minister of India  
 (C) Chairman of Rajya Sabha (D) Speaker of Lok Sabha  
 નાણાં પંચની નિમજ્જુક કોષા કરે છે ?  
 (A) ભારતના રાખ્રપતિ (B) ભારતના પ્રધાનમંત્રી  
 (C) રાજ્યસભાના અધ્યક્ષ (D) લોકસભાના સ્પીકર

82 Capital Redemption Reserve is utilized .....

- (A) To redeem Preference Shares  
 (B) To redeem Debentures  
 (C) To issue of Bonus Shares  
 (D) None of the above

મૂડી પરત અનામતનો ઉપયોગ \_\_\_\_\_ માટે થાય છે.

- (A) પ્રેફરન્સ શેરને પરત કરવા  
 (B) ડિબેન્ચરને પરત કરવા  
 (C) બોનસ શેર આપવા  
 (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

83 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

‘ખડૂકો’

- (A) ખડતલ (B) ખડેર  
 (C) ધોંધ (D) ટેકરો

84 Dividends are usually paid upon :

- (A) Paid up capital (B) Called up capital  
 (C) Issued capital (D) Reserve capital

ઉવિડન્ડ સામાન્ય રીતે \_\_\_\_\_ પર ચૂકવવામાં આવે છે.

- (A) ભરપાઈ થયેલ મૂડી (B) મંગાવેલી મૂડી  
 (C) બહાર પાડેલી મૂડી (D) અનામત મૂડી

85 કલિકાલસર્વક્ષ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.

- (A) ધરમપુર (B) ધોળકા  
 (C) ધંધુકા (D) ધનસુરા

86 Audit of banks is an example of \_\_\_\_\_.

- (A) Statutory audit (B) Balance sheet audit  
 (C) Concurrent audit (D) All of the above

બેંકોનું ઓડિટ એ \_\_\_\_\_ નું ઉદાહરણ છે.

- (A) વૈધાનિક ઓડિટ (B) બેલેન્સ શીટ ઓડિટ  
 (C) સહવર્તી ઓડિટ (D) ઉપરોક્ત તમામ

87 What does FIFO mean ?

- (A) Finished stock In Finished stock out
- (B) Fabrications Inward Fabrications Outward
- (C) Final Input Final Output
- (D) First In First Out

FIFOનો અર્થ શું છે ?

- (A) ફિનિશડ સ્ટોક ઈન ફિનિશડ સ્ટોક આઉટ
- (B) ફેબ્રિકેશન્સ ઈનવર્ડ ફેબ્રિકેશન્સ આઉટવર્ડ
- (C) ફાઈનલ ઈનપુટ ફાઈનલ આઉટપુટ
- (D) ફસ્ટ ઈન ફસ્ટ આઉટ

88 The government budget shows the government's .....

- (A) Actual receipts and expenditures
- (B) Estimated receipts only
- (C) Estimated expenditures only
- (D) Estimated receipts and expenditures

સરકારનું બજેટ એ સરકારની ..... બતાવે છે.

- (A) વાસ્તવિક આવક અને ખર્ચ
- (B) માત્ર અંદાજિત આવકો
- (C) માત્ર અંદાજિત ખર્ચ
- (D) અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચ

89 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ "ગ્રામ" શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

- (A) કલમ - 243(ઝ)
- (B) કલમ - 243(જ)
- (C) કલમ - 244(જ)
- (D) કલમ - 245(જ)

90 Management accounting maintains -

- (A) Journal
- (B) Ledger
- (C) Trial Balance
- (D) None of the above

સંચાલકીય હિસાબી પદ્ધતિમાં \_\_\_\_\_ બનાવવામાં આવે છે.

- (A) આમનોંધ
- (B) ભાતાવહી
- (C) કાચું સરવૈયું
- (D) ઉપરોક્ત પેકી એકપણ નહીં

91 Fill in the blank.

They \_\_\_\_\_ touch pitch will be defiled.

- (A) whom
- (B) those
- (C) whose
- (D) that

92 How often does the Census Bureau take a complete population count?

- (A) Every year (B) Every five years  
(C) Every ten years (D) Twice a year
- વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે?  
(A) દર વર્ષ (B) દર પાંચ વર્ષ  
(C) દર દસ વર્ષ (D) વર્ષ બે વાર

93 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્માણપ્રયોગ જણાવો.

મિથુને ઉર્વાની પીઠ પર હાથ મૂક્યો.

- (A) મિથુનથી ઉર્વાની પીઠ પર હાથ મૂકાયો  
(B) મિથુનથી ઉર્વાથી પીઠ પર હાથ મૂકે છે  
(C) મિથુનથી ઉર્વાની પીઠ પર હાથ મૂકાશે  
(D) મિથુનથી ઉર્વાની પીઠ પર હાથ મૂકાવશે

94 If value of coefficient of skewness is negative, then it implies that ....

- (A) Mode is larger than the arithmetic mean.  
(B) Arithmetic mean is larger than mode.  
(C) Arithmetic mean and mode are same.  
(D) Arithmetic mean is zero.

જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે.....

- (A) સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે.  
(B) બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે.  
(C) સમાંતર મધ્યક અને બહુલક બંને સરખા છે.  
(D) સમાંતર મધ્યક શૂન્ય છે.

95 Standard deviation of first  $n$  natural numbers is :

(A)  $\frac{n(n+1)(2n+1)}{6}$  (B)  $\frac{n^2 - 1}{12}$

(C)  $\sqrt{\frac{n^2 - 1}{12}}$

પ્રથમ  $n$  પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન.....

(A)  $\frac{n(n+1)(2n+1)}{6}$

(C)  $\sqrt{\frac{n^2 - 1}{12}}$

(B)  $\frac{n^2 - 1}{12}$

(D) ઉપરોક્ત પૈકી એકપણ નથી

- 96 ✓ Znના સળિયાને કોપર નાઇટ્રોટના દ્રાવકશમાં મૂકી અવલોકન કરતાં .....  
 (A) Zn પર Cu જમા થાય છે                           (B) Cu પર Zn જમા થાય છે  
 (C)  $Cu^{2+}$  નું ઓક્સિડેશન થાય છે                   (D) દ્રાવકશનો વાદળી રંગ ધારો બને



એક મશીન જેણી પડતર કિમત રૂ. 1,20,000 છે. એકનિત ઘસારો અવમૂલ્યના રૂ. 50,000 છે. મશીનની ચોપડે કિમત કેટલી થશે ?



$$\omega_P = 6 \text{ rad/s}$$



~~78699~~

It is generally assumed that the business will not liquidate in the near foreseeable future because of

$$\omega^{\rho} = \omega^5$$

- |                 |                   |
|-----------------|-------------------|
| (A) Periodicity | (B) Materiality   |
| (C) Matching    | (D) Going Concern |

3

ના ખ્યાલને કારણો નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે.

- (A) સામયિકતા (B) ભૌતિકતા  
(C) મેથિંગ (D) ચાલુ પેઢી

- 100 ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

- (A) માનસિંહજી રાણી (B) બળવંતરાય ઠાકોર  
 (C) કલ્યાણજી મહેતા (D) કુંદનલાલ ધોળકીયા

- 101 Ten years ago person A was half of person B in age. If the ratio of their present ages is 3:4, what is the sum of their present ages ?



દસ વર્ષ પહેલાં માણસ Aની ઉંમર, માણસ B કરતાં અડધી હતી. જો હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હોય, તો તેઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય ?

- (A) 8  $\sqrt{3}$       (B) 20  $\sqrt{3}$   
 (C) 35  $\sqrt{3}$       (D) 45  $\sqrt{3}$

- 102 Which of the following statements is true about the Primary deficit ?
- It is difference between Revenue receipts and Revenue Expenditure.
  - It is difference between Capital receipts and Interest Payment.
  - It is difference between the Fiscal Deficit and Interest Payment.
  - It is addition of Fiscal Deficit and Interest Payment.

નીચેનામાંથી ક્યું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ?

- તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.
- તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
- તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
- તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.

- 103 The value of  $\sum_{n=1}^{\infty} \frac{n^3 - 3n^2 + 2n - 6}{n!}$  is \_\_\_\_\_.

- $5 - 6e$
- $6 - 5e$
- $6(e - 1)$
- does not exist

અનંતશ્રેણી  $\sum_{n=1}^{\infty} \frac{n^3 - 3n^2 + 2n - 6}{n!}$  ની કિમત \_\_\_\_\_.

- $5 - 6e$
- $6 - 5e$
- $6(e - 1)$
- નામળે

- 104 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.

કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું -

- સલવટ
- પલવટ
- કેરિયું
- કટિમેખલા

- 105 Accounting Standards in India are issued by .....

- The Securities and Exchange Board of India (SEBI)
- The Bombay Stock Exchange (BSE)
- The Institute of Chartered Accountants of India (ICAI)
- The Reserve Bank of India (RBI)

ભારતમાં હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

- સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)
- બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)
- ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટરડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)

106 Number  $9^n - 1$ ,  $\forall n \geq 1$  is \_\_\_\_\_.

- (A) prime (B) odd  
(C) even (D) None of the above

સંખ્યા  $9^n - 1$ ,  $\forall n \geq 1$  એ \_\_\_\_\_ છે.

- (A) અવિભાજ્ય (B) એકી  
(C) બેકી (D) ઉપરોક્ત પેકી એકપણ નહીં

107 If the demand for money is perfectly interest inelastic, the LM schedule will be

- (A) Upward sloping (B) Downward sloping  
(C) Horizontal line (D) Vertical line

જો નાણાંની માંગ સંપૂર્ણપણે વાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ?

- (A) ધન ઢાળ (B) ઋણ ઢાળ  
(C) આડી રેખા (D) ઉભી રેખા

108 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ?

- (A) સુરેન્દ્રનગર - કચ્છ (B) કચ્છ - બનાસકાંઠા  
(C) બનાસકાંઠા - મહેસાણા (D) સાબરકાંઠા - મહેસાણા

109 Which of the following is broad money in India ?

- (A) Currency with public + demand deposits in the banks  
(B) Currency with public + demand deposits in the banks + other deposits with RBI  
(C) Currency with public + demand deposits in the banks + time deposits in the banks  
(D) Currency with public + demand deposits in the banks + time deposits in the banks + other deposits with RBI

ભારત દેશમાં નીચેનામાંથી ક્યું વિસ્તૃત નાણું છે ?

- (A) લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો  
(B) લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો  
(C) લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો  
(D) લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો

110 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્ય શોધો.

પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા

- (A) પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા  
(B) પાર્વતીથી થીંગડાં મરાશે  
(C) પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા  
(D) પાર્વતીનું જીવન થીંગનું હતું

- 111 Discount on issue of debentures is a \_\_\_\_\_.
- Revenue loss to be charged in the year of issue
  - Capital loss to be written off from capital reserve
  - Capital loss to be written off over the tenure of the debentures
  - Capital loss to be shown as goodwill
- વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ .....
- મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે
  - મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે
  - મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકળમાં માંડી વાળવામાં આવે છે
  - મૂડી ખોટ છે કે જે પાંદડી તરીકે દર્શાવવામાં આવે છે

- 112 એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?
- 20
  - 30
  - 40
  - 45

- 113 Consider the following taxes :

1. Corporation tax, 2. Customs duty, 3. Wealth tax, 4. Excise duty.

Which of the above is/are indirect taxes ?

- 1 only
- 2 and 4
- 1 and 3
- 1, 2 and 3

નીચેના કરને ધ્યાનમાં લો :

1. કોર્પોરેશન વેરો, 2. કસ્ટમ જ્યૂટી, 3. સંપત્તિ વેરો, 4. આભકારી વેરો.  
ઉપરના પૈકી કયા પરોક્ષ કર છે ?

- ફક્ત 1
- 2 અને 4
- 1 અને 3
- 1, 2 અને 3

- 114 The liabilities of an auditor can be

- Civil
- Criminal
- Civil and Criminal
- Financial

ઓડિટરની જવાબદારીઓ \_\_\_\_\_ હોઈ શકે છે.

- દીવાની
- ફોજદારી
- દીવાની અને ફોજદારી
- નાણાકીય

- 115 During September, Ramesh had sales of Rs. 1,48,000, which made a gross profit of Rs. 40,000. Purchases amounted to Rs. 1,00,000 and opening stock was Rs. 34,000. Find out the value of closing stock.

- Rs. 24,000
- Rs. 26,000
- Rs. 42,000
- Rs. 54,000

સપ્ટેમ્બર દરમયાન રમેશ રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો.

- રૂ. 24,000
- રૂ. 26,000
- રૂ. 42,000
- રૂ. 54,000

116 Which one of the following bodies will decide the tax rates for goods and services under GST regime ?

- (A) Central and State government
- (B) Finance Commission
- (C) NITI Aayog
- (D) GST Council

જીએસ્ટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ?

- (A) કેન્દ્ર અને રાજ્ય સરકાર
- (B) નાણાં પંચ
- (C) નીતિ આયોગ
- (D) જીએસ્ટી કાઉન્સિલ

117 કમ્પ્યુટરમાં ફોન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે ક્યા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ?

- (A) વેક્ટર ઈમેજ
- (B) રાસ્ટર ઈમેજ
- (C) બિટમેપ ઈમેજ
- (D) પોર્ટબલ ઈમેજ

118 Capital Structure is said to be optimal when \_\_\_\_\_.

- (A) Weighted Average Capital Cost (WACC) tends to decline
- (B) Weighted Average Capital Cost (WACC) is the lowest
- (C) Cash is sufficient to meet debt
- (D) None of the above

ઇન્દ્રતમ મૂડી માળખું ક્યારે કહેવાય ?

- (A) ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહેતી
- (B) ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ છીએ
- (C) દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય
- (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

119 In \_\_\_\_\_ approach, the capital structure decision is relevant to the Valuation of the firm.

- (A) Net Income
- (B) Net Operating Income
- (C) Traditional
- (D) Modigliani and Miller

અભિગમ હેઠળ મૂડી માળખાનો નિર્ણય પેઢીના મૂલ્યાંકન સાથે સુસંગત હોય છે.

- (A) ચોખ્ખી આવક
- (B) ચોખ્ખી કાર્યકારી આવક
- (C) પરંપરાગત
- (D) મોડિગિલાની-મિલર

120 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :

- |                        |     |                    |
|------------------------|-----|--------------------|
| (a) સુરસિંહજી ગોહિલ    | (1) | કલાપી              |
| (b) બાલાશંકર કંથારિયા  | (2) | દ્વિરેષ            |
| (c) રામનારાયણ પાઠક     | (3) | લલિત               |
| (d) જમનાશંકર ભૂય       | (4) | કલાન્ત             |
| (A) c-2, a-1, d-3, b-4 | (B) | a-1, b-3, d-2, c-4 |
| (C) b-2, c-4, a-3, d-1 | (D) | d-4, c-2, b-1, a-3 |

121 Which of the following tax is not subsumed by GST ?

- ✓ (A) Purchase tax (B) Entry tax  
(C) Luxury tax (D) Stamp Duty

જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ?

- (A) ખરીદી ઉપરનો કર (B) પ્રવેશ કર  
(C) મોજશોખની વસ્તુ પર કર (D) સ્ટેમ્પ ડાયુટી

122 અવંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.

- કે કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું  
(A) યમક (B) ઉત્પ્રેક્ષા  
(C) અંત્યાનુપ્રાસ (D) આંતરપ્રાસ

123 Redeemable preference shares must be redeemed within :

- ✓ (A) 5 years (B) 10 years  
(C) 15 years (D) 20 years

રીડીમેબલ પ્રેફરન્સ શેરને કેટલાં વર્ષમાં પરત કરવા આવશ્યક છે ?

- (A) 5 વર્ષ (B) 10 વર્ષ  
(C) 15 વર્ષ (D) 20 વર્ષ

124 Fill in the blank.

Antonym of adjustment is \_\_\_\_\_.

- (A) in-adjustment (B) adjustable  
(C) mal-adjustment (D) non-adjustment

125 Capital Budgeting is related to \_\_\_\_\_.

- ✓ (A) Long term assets (B) Short term assets  
(C) Fixed assets (D) None of the above

મૂડી બજેટ \_\_\_\_\_ સાથે સંબંધિત છે.

- (A) લાંબાગાળાની મિલકતો (B) દૂંગાળાની મિલકતો  
(C) સ્થિર મિલકતો (D) ઉપરોક્ત પૈકી એકપણ નથી

126 To reduce the Type-I as well as Type-II error, we should -

- (A) Decrease the sample size
- (B) Increase the sample size
- (C) Take sample size as small as possible
- (D) None of the above

પ્રથમ પ્રકારની ભૂલ તેમજ દ્વિતીય પ્રકારની ભૂલ ઘટાડવા માટે જોઈએ.

- (A) નિર્દર્શનું કદ ઘટાડવું
- (B) નિર્દર્શનું કદ વધારવું
- (C) નિર્દર્શનું કદ શક્ય હોય તેટલું નાનું લેવું
- (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

127 The bridge being constructed on the Nyle, is the longest bridge of the world. (Use 'Adjective clause')

- (A) The bridge is being constructed on Nyle is the longest bridge of the world.
- (B) The bridge that was being constructed on Nyle is the longest bridge of the world.
- (C) The bridge what is being constructed on Nyle is the longest bridge of the world.
- (D) The bridge which is being constructed on the Nyle is the longest bridge of the world.

128 The concept of vicious cycle of poverty is associated with

- (A) J.M. Keynes
- (B) Regner Nurkse
- (C) Karl Marx
- (D) J.S. Mill

ગુરીબીના વિખચકનો ઘાલ કોની સાથે સંબંધિત છે ?

- (A) જે.એમ. કેઇન્સ
- (B) રેગનર નર્ક્સ
- (C) કાર્લ માર્ક્સ
- (D) જે.એસ. મિલ

129 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

તું શું કરી શકે ?

- (A) તારાથી શું કરી શકાય ?
- (B) તારાથી શું કરાઈ શકે ?
- (C) તારાથી બધું કરી શકાશે
- (D) બધું જ કરી શકાય તારાથી

130 As per 2011 census, which state in India is with the highest rural population ?

- (A) Madhya Pradesh
- (B) Maharashtra
- (C) Punjab
- (D) Uttar Pradesh

2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ?

- (A) મધ્ય પ્રદેશ
- (B) મહારાષ્ટ્ર
- (C) પੰજાਬ
- (D) ઉત્તર પ્રદેશ

131 રૂધિપ્રયોગનો સાચો અર્થ શોધો.

- દૂષે ધોઈને આપવા  
(A) પ્રામાણિકપણે ચૂકતે કરવું  
(C) સત્ય ન હોવું

- (B) અપ્રામાણિક હોવું  
(D) ઉજળું કરવું

132 The unknown population quantities associated with the population distribution is called :

- (A) Sample Constant (B) Estimator  
(C) Parameter (D) All of the above

સમાચિના વિતરણ સાથે સંબંધિત અજાત સમાચિની લાક્ષણિકતાને \_\_\_\_\_ કહે છે.

- (A) નિર્દર્શ અચળાંક (B) આગણક  
(C) પ્રાચલ (D) ઉપરોક્ત તમામ

133 \_\_\_\_\_ is the correct sequence of payment of dues on dissolution of a partnership firm.

- (A) Partner's loan - Capital - Creditors - Secured loan  
(B) Creditors - Secured loan - Partner's loan - Capital  
(C) Secured loan - Partner's loan - Creditors - Capital  
(D) Secured loan - Creditors - Partner's loan - Capital  
ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચૂકવણીનો યોગ્ય કમ કર્યો છે ?

- (A) ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન  
(B) લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી  
(C) સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી  
(D) સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી

134 Fill in the blank.

- Sir, this is the \_\_\_\_\_ price I can take.  
(A) most little (B) littlest  
(C) little (D) least

135 In which tool of financial analysis, change compared to last year is presented in percentage ?

- (A) Comparative statement (B) Common size statement  
(C) Accounting Ratio (D) Cash flow statement

નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં ૨૫ કરવામાં આવે છે ?

- (A) તુલનાત્મક પત્રકો (B) સામાન્ય માપનાં પત્રકો  
(C) ડિસાબી ગુણોત્તર (D) રોકડ પ્રવાહ પત્રકો

136 'પંચાયતી રાજ દિવસ'ને કઈ તારીખે મનાવવામાં આવે છે ?

- (A) 15 ડિસેમ્બર (B) 24 એપ્રિલ  
(C) 28 જાન્યુઆરી (D) 1 મે

137 Traditional approach confines Finance function only to \_\_\_\_\_ funds.

- (A) Raising of Finance (B) Mobilising of Finance  
(C) Utilisation of Finance (D) Financing

પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર \_\_\_\_\_ પૂર્તું મર્યાદિત છે.

- (A) નાણાં ઉભા કરવા (B) નાણાંની ગતિશીલતા વધારવી  
(C) નાણાંનો વપરાશ કરવો (D) નાણાંનું વિરાષ કરવું


138 ABCDમાં ( $A \rightarrow Z = 1 \rightarrow 26$ ) મુજબ જોતાં  $J-B = H$ ,  $P-L = D$  અને  $X-Q = G$  હોય, તો  $M-D = \underline{\hspace{2cm}}$ .

- (A) I (B) V  
(C) O (D) E

139 Consider a point  $A(0,2)$  and  $B(1,1)$  in the  $XY$  plane, consider all possible paths  $APB$  where  $P$  is an arbitrary point on  $x$ -axis and  $AP$  and  $PB$  are straight line segment. Then the coordinate of the point  $P$  such that the length of the path  $APB$  is shortest among all such possible paths is :

$XY$ -સમતલમાં બિંદુઓ  $A(0,2)$  અને  $B(1,1)$  લેતાં, તથા  $x$ -અક્ષ પર યદ્યચ્છ બિંદુ  $P$  ને જોડાતા રેખાખંડો  $AP$  અને  $PB$  થી બનતા બધા પથ  $APB$  લેતાં સૌથી ટૂકો  $APB$  પથ બને તે માટે બિંદુ  $P$  નાં યામ \_\_\_\_\_ થાય.

- (A) (0, 0) (B) (0,  $\frac{1}{2}$ )  
(C) (0.5, 0) (D) (1, 0)




140 An estimate of population parameter given two numbers in which the parameter may be considered to lie is called :

- (A) Interval estimate of the parameter  
(B) Interval estimator of the sample  
(C) Point estimate of the parameter  
(D) None of the above

સમાચિના પ્રાચલના આગણાન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમાચિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને \_\_\_\_\_ કહે છે.

- (A) પ્રાચલનું અંતરાલ આગણાન  
(B) નિર્દર્શનું અંતરાલ આગણાન  
(C) પ્રાચલનું બિંદુ આગણાન  
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં



141 The (Monopolistic and Restrictive Trade Practice) MRTP Act of 1969 has been replaced by

- (A) Competition Act 2002
- (B) Merged in Industrial Policy Act of 1978
- (C) Trade Union Amendment Act 2001
- (D) Merged in Industrial Policy Act of 1991

વર્ષ 1969ના (ઇજારાશાહી અને પ્રતિબંધક વેપાર પ્રથા) એમ.આર.ટી.પી. એકટના સ્થાને ક્યો એકટ અમલમાં આવેલ છે?

- (A) કોમ્પ્યુટિશન એકટ, 2002
- (B) વર્ષ 1978ની ઔદ્ઘોગિક નીતિ એકટમાં સમાવિષ્ટ થયેલ
- (C) વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એકટ
- (D) વર્ષ 1991ની ઔદ્ઘોગિક નીતિ એકટમાં સમાવિષ્ટ થયેલ

142 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

ચૂંઠું

(A) શોધણા

(C) ટપકવું

(B) ચૂસવું

(D) ટપવું

143 If probability of having a male or female child is equal, then the probability that woman's fourth child will be her first son is :

- (A) 0.0625
- (B) 0.078
- (C) 0.342
- (D) None of the above

જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના.....

- (A) 0.0625
- (B) 0.078
- (C) 0.342
- (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

144 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે?

- (A) બે
- (B) ચાર
- (C) ત્રણ
- (D) પાંચ

145 If  $1! + 2! + \dots + 95! = a \pmod{15}$ , then  $a = \underline{\hspace{2cm}}$ .

જો  $1! + 2! + \dots + 95! = a \pmod{15}$ , તો  $a = \underline{\hspace{2cm}}$ .

- (A) 0
- (B) 1
- (C) 2
- (D) 3

146 ગુજરાતની પ્રસિદ્ધ નવલક્ષ્યા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

- (A) કવિ દલપત્રામ (B) જવેરચંદ મેધાણી  
(C) ગોવર્ધનરામ ત્રિપાઠી (D) કવિ સુંદરમુ

147 If the fair value of an equity share of a company is Rs. 450 and its market value is Rs. 420, then the intrinsic value of share is \_\_\_\_\_.

- (A) Rs. 480 (B) Rs. 440  
(C) Rs. 870 (D) Rs. 400

જો કોઈ કંપનીના ઈક્વિટી શેરનું વાજબી મૂલ્ય રૂ. 450 છે અને તેનું બજાર મૂલ્ય રૂ. 420 હોય, તો શેરનું આંતરિક મૂલ્ય \_\_\_\_\_ થાય.

- (A) રૂ. 480 (B) રૂ. 440  
(C) રૂ. 870 (D) રૂ. 400

148 As a costing team member, calculate the gross profit; if sales Rs. 6000; cost of sales Rs. 5000; opening stock Rs. 1,000; purchases Rs. 4000; wages Rs. 2,000 and office rent Rs. 1,000.

- (A) Loss Rs. 2,500 (B) Loss Rs. 1,500  
(C) Profit Rs. 2,500 (D) Profit Rs. 1,000

જો વેચાણ રૂ. 6000, વેચાણ મડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ. 1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો.

- (A) રૂ. 2,500 ખોટ (B) રૂ. 1,500 ખોટ  
(C) રૂ. 2,500 નફો (D) રૂ. 1,000 નફો

149 Which one of the following is a 'Variable Cost' ?

- (A) Indirect Material (B) Administrative Staff Salary  
(C) Salesman's Commission (D) Interest on Bank Loan

નીચેનામાંથી કયો "ચલિત ખર્ચ" છે ?

- (A) પરોક્ષ માલ-સામાન (B) વહીવટી કર્મચારીઓનો પગાર  
(C) સેલ્સમેન કમિશન (D) બેંક લોન પર વ્યાજ

150 ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

- (A) હરિલાલ કણિકા (B) પી.એન.પટેલ  
(C) ચીમનાલાલ વાણિકા (D) એન.એસ. ઠક્કર